

# ભાનસિક સ્વાસ્થ્ય અને આપણે



મગજ અને  
ભાનસિક રોગ  
અંગેની  
માહિતી આપતુ  
ત્રિમાસીક  
મેગેઝીન

તંત્રી : ડૉ. આઈ. જે. રત્નાણી

Vol : 3 Issue : 2      Quarterly      Price Rs.12/-  
April - June, 2019      BHAVNAGAR



<https://drijratnani.com/>

drijratnani@gmail.com



/DocRatnani



9925056695

Videos : Dr. I. J. Ratnani Psychiatrist

## અનુકમણીકા

૧. તંત્રી સ્થાને થી	૨
૨. એક ડોક્ટર પોતાની માનસિક બિમારીની વાત કરે છે હા ! એક ડોક્ટર પણ મનોરોગી હોઈ શકે છે	૩
૩. ૨૨ વર્ષની ચુવતી ને લાગતુ કે કોઈ મારા વિશ્વદ્ય ખડયંત્ર રચી રહ્યુ છે અને મને નુકશાન પહોંચાડવા માગે છે	૮
૪. જ્યારે પિતાએ માનસિક બિમારીથી કંટાળી પુત્રને ત્યજી દેવાનો નિર્ણય કર્યો	૧૧
૫. સેક્સ સમસ્યાઓ (પુરુષોની) સચિત્ર : ભાગ-૨	૧૭
૬. કસરત અને માનસિક સ્વાસ્થ્ય	૧૯
૭. How Depression look like ?	૨૨

### ૧. તંત્રી સ્થાને થી.....



આજે આ મેગેઝીનનો સંંગ આઠમો અંક આપની સમક્ષા મુક્તા આનંદ અનુભવાય છે.

માનસિક બિમારી અંગે સત્યકથાની “આપવીતી” શ્રેણી જેમા દર્દીઓ પોતેજ પોતાના અનુભવો અંગત વિગતો બદલીને વણવે છે તેમજ માનસિક રોગ ના ક્ષેત્રે છેલ્લા

આઠ વર્ષથી કાર્યરત એવા શ્રી રોહીતભાઈ જોધી એ વર્ણવિલ સત્યકથા સમાવેલ છે તેમજ માનસિક બિમારી કેવા સામાજિક પ્રશ્નો ઉભા કરે છે તેની શ્રેણી “દર્પણ” નામથી શરૂ કરેલ છે.

ડૉ.શ્રેયાબેન નો કસરત અગેનો આર્ટિકલ તેમજ ડૉ.ઇલાબેનનો ડિપ્રેશન નો આર્ટિકલ પણ રસપ્રદ બની રહેશે. તેમજ સચિત્ર વિભાગમાં સેક્સ સમસ્યા અંગે ચર્ચા કરેલ છે.

**ડૉ. આઈ. જે. રત્નાણી**

**૨. એક ડોકટર પોતાની માનસિક બિમારીની વાત કરે છે હા !  
એક ડોકટર પણ મનોરોગી હોઈ શકે છે.**

**આ આર્ટિકલ - દર્દીએ જાતે લખેલ સત્યકથા છે.**

નમસ્તે મિત્રો,

હું એક ડોકટર છુ અને મને થયેલ માનસિક બિમારીનો અનુભવ આજે આ મેગેઝીન મારફતે આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું.

માનસિક બિમારીનું વરસુ સ્વરૂપ મે મારા બાળપણામાં જ જોઈ લીધેલુ. મારી માતાને



**‘‘બાયપોલર મુસ**

**ડિસારોર્ડ’’**

તરીકે ઓળખાતી

માનસિક બિમારી હતી.

જેમાં ડિપ્રેશન (ઉદાસી)

અને મેનિયા (ઉન્માદ-ઉંસાહ) ના લક્ષણો જોવા મળે છે. માતાને અનુભવાતી ઉદાસી, ગુસ્સો, અનિદ્રા જેવી તકલીફો, જેની સારવાર માટે ભુત - પ્રેત-બાધા-દોરા-ધાગા-મંત્ર-તંત્ર માટે ઢોડી જતા પરિવારજનો, વરચે-વરચે થોડો નોર્મલ સમય પસાર થાય અને ફરી બિમારી ઉથલો મારે. મારા સ્કુલના ઇંવસો કંઈક આમ



જ પસાર થયા. આ દરમિયાન ઈ.સ. ૧૯૬૫માં માતાને મનોચિકિત્સકની દવાઓથી ઘણો ફાયદો થયો. વરચે - વરચે કચારેક - કચારેક માનસિક બિમારી ઉથલો મારતી પણ મહંદ અંશે તબિયત સારી રહી. હાલ પણ

માતાની માનસિક બીમારી અને એક અંતર રાખી વર્તતા કુટુંબીજનો વચ્ચે મારુ બાળપણ અને શાળાનો અભ્યાસ વિત્યા. આખરે મેં ઉચ્ચય કમાડે ઉતીર્ણ થઈ એમ.બી.બી.એસ. માં પ્રવેશ મેળવ્યો.

તેની માનસિક તકલીફમાં ઘણું સારુ છે. આમ, મારા સ્કુલના દિવસો દરમિયાન જ માનસિક બિમારીના લીધે દર્દી અને તેના કુટુંબીજનો પર થતા વિષમ અનુભવો અનુભવેલા. આ વાતાવરણ વરચે પણ જ્યારે કુટુંબીજનો એક અંતર રાખી વર્તવાનું પસંદ કરે છે મારુ બાળપણ અને શાળાનો અભ્યાસ વિતતો ગયો. આખરે શાળામાં ઉચ્ચય કમાડે ઉતીર્ણ થઈ મેં મેડીકલમાં પ્રવેશ મેળવ્યો અને મારો એમ.બી.બી.એસ. નો અભ્યાસ શરૂ થયો.

ડિપ્રેશનનો પ્રથમ અનુભવ મને ઈ.સ. ૨૦૦૧માં થયો. મેં મારો શાળાકીય અભ્યાસ ગુજરાતી માદ્યમમાં કરેલો. અને એમ.બી.બી.એસ.નો અભ્યાસક્રમ અંગ્રેજી ભાષામાં હોઈ અભ્યાસમાં થોડી તકલીફ પડતી. આ દરમિયાન મારી એમ.બી.બી.એસ. ના પ્રથમ વર્ષની પરિક્ષા નજીક હતી. હું થોડો ટેન્શનમાં પણ હતો. આ દરમિયાન એક જ્યોતિષને મળવાનું થયું જેમણે મારુ નકારતમક ભવિષ્ય જણાવ્યું. આ દરમિયાન હું ચિંતા અને વિચારોથી ઘેરાઈ ગયો. અને આખરે મેં જીવનમાં પ્રથમ વખત

મનોચિકિત્સકની મુલાકાત લીધી. જેમણે પરિક્ષાના લીધે થયેલ કામચલાવ સ્ટ્રેસની તકલીફનું નિદાન કરી સામાન્ય દવાઓ આપી. આજરે પરિક્ષા પુર્ણ થઈ અને



પરિણામ પણ સારુ જ આવ્યુ અને બધુ જાણો વિસરાઈ ગયું. જોકે વરચે વરચે કચારેક ટેન્શન-સ્ટ્રેસ વધી જતા હું મેડિકલ કોલેજમાં જ મનોચિકિત્સક ડોક્ટરને મળી આવતો અને ટુંકા ગાળાની સારવાર લેતો. હવે કચારેક હું પાછુ વળીને વિચારુ તો જણાય કે આ રીતે તુટક - તુટક સારવાર લેવામાં અને અધ-વરચે સારવાર છોડવામાં કદાચ મારી જાતને મનોરોગી તરીકે સ્વિકારવાનો કાલ્પનિક ભય જવાબદાર હતો. જો એક ડોક્ટર તરીકે પણ મને આ ભયને કાબુ કરવામાં ઘણી તકલીફ થયેલી તો સામાન્ય વ્યકિતાનોને અનુભવાતા સામાજિક અસ્વિકૃતીના ભયને હું કલ્પી

શકુ છું.

મારા એમ.બી.બી.એસ. ના અભ્યાસનો સમયગાળો આમ ડિપ્રેશન-સ્ટ્રેસ-ચિંતા-બેચેનીના સામાન્ય લક્ષણો વરચે વિટેલો. વરચે-વરચે ક મ ચ લ ઊ લી ધો લ મનોચિકિત્સકની મુલાકાતો

અભ્યાસ દરમિયાન વરચે કચારેક ચિંતા ટેન્શન વધી જાય. તો હું મનોચિકિત્સક ને મળી ટુંકા ગાળાની દવાઓ સારવાર લઈ અધ-વરચે છોડી દેતો. કદાચ હું મારી જાતને એક મનોરોગી તરીકે સ્વિકારવા તૈયાર ન હતો.

અને ટુંકાગાળાની સારવાર પરંતુ મારા ગ્રેજ્યુએશન બાદ મે ડિપ્રેશનનું વરષુ સ્વરૂપ ઈ.સ. ૨૦૦૫-૨૦૦૭માં પ્રથમ વખત અનુભવ્યું. જેમાં ગંભીર ડિપ્રેશન, આત્મવિશ્વાસનો અભાવ, સતત રક્વાનું કોઈ કારણ વિના વિચારશુન્ય થઈ જવું અને તે પણ કોઈ પ્રકારના બાધ્ય પરિબળો, સ્ટ્રેસ કે વિપરીત સંજોગો વિના. આ દરમિયાન સતત આત્મહંત્યાના વિચારો આવતા અને એક - બે

**મારો એમ.બી.બી.સી.એસ. નો અભ્યાસ  
પુરી થયા બાદ ડિપ્રેશન નું વરષુ સ્વરૂપ મેં  
પ્રથમ વખત અનુભવ્યું. જેમાં સતત રક્વુ,  
કોઈ કારણ વિના વિચાર શુન્ય થઈ જવું  
અને તે પણ કોઈ સ્ટ્રેસ કે વિપરીત સંજોગો  
વિના સતત આત્મહંત્યાના વિચારો અને  
એક-બે કાચા પ્રથતનો પણ ખરા.**

કાચા પ્રથતનો પણ કર્યા પણ સદ - નસિબે બચી ગયેલ. અ। દ ૨ મિયાન ફરી મનોચિકિત્સકનો સંપર્ક સારવાર અને સારુ થતા નોર્મલ રૂટીન. મેં ત્યારબાદ બે થી ત્રણ વર્ષ દવાઓ નિયમીત શરૂ રાખેલ, પણ છેવટે સારુ થઈ જતા રોજુંંદા જુવનમાં પોરવાઈ ગયેલ.

આ દરમિયાન હું આ બિમારીનું કોઈ લાંબાગાળાનું નિરાકરણ દર્શાતો હતો. એટલે મનોચિકિત્સક ને મળ્યો. અને મારી વાત કરી. આ દરમિયાન હું ઓબ્સેસિવ કમ્પ્લાઝીવ ડિસાર્કર (ધૂનરોગ)ના લક્ષણોથી પરેશાન હતો. જેમા મારા પોકેટની વસ્તુઓ જેવી કે પર્સ, મોબાઇલ, ઘડીયાળ, પેન, ચાવી, રૂમાલ વગેરેનું સતત એક માનસિક ચિંતન અને ચેકીંગ કરતો રહુ છું. અને ધણી વખત આ ચેકીંગ કરવું જાણો એક મજબુરી બની જાય

અને હું આજુબાજુના વાતાવરણ અને વ્યક્તિત્વોની પરવાહ કર્યા વિના જાણો ચેકીંગમાં જ વ્યસ્ત બની જઉ વગેરે ચિન્હોથી ત્રસ્ત હતો.

મારી મનોચિકિત્સક સાથે મારી બિમારી બાબતે વિસ્તૃત વાત થઈ. મારી ભાતાની માનસિક બિમારી, મને ભુતકાળમાં વારંવાર થયેલ ડિપ્રેશન ના અનુભવો અને વરચ્યે એક વખત થયેલ ગંભીર ડિપ્રેશન અને આપદ્યાતના વિચારો વગેરે વગેરે. અલબત્ત આ દરમિયાન વરચ્યેના સમયગાળામાં હું તદ્દન સ્વસ્થ રહેતો કે જાણો કંઈ છે જ નહીં. અને હાલ મને ડિપ્રેશન ઉપરાંત ધૂનરોગ - ઓબ્સેસિવ ક્રમપદ્ધીય ડિસઓર્ડરના ચિન્હો પરેશાન કરી રહ્યા હતા. મનોચિકિત્સકે મને મારી બિમારી બાયપોલર મુક ડિસઓર્ડર હોવાનું જણાવ્યુ. અને હાલ અનુભવાતા ધૂનરોગના લક્ષણો પણ તેનો ભાગ હોઈ શકે છે. અને મારી સારવાર શરૂ થઈ.

હાલ મારી સારવાર શરૂ છે. લગભગ ૮૦ થી ૮૫% તકલીફો દુર થઈ ચુકી છે. અને થોડા વિચારો અને આ વિચારો વધી જતા મજબુરીથી કરવું પડતુ મોબાઇલ, ઘડીયાળ, ઝ્રમાલ જેવી નાની નાની વસ્તુઓનું ચેકીંગ વગેરે પર “‘બિ હે વી ચ ર થેરાપી’” વડે પણ જાતે કાબુ મેળવવા કોશિશ કરી રહ્યો છુ. અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છુ.

\* \* \* \* \*

**૩. ૨૨ વર્ષની યુવતી ને લાગતુ કે કોઈ મારા વિરુદ્ધ ખડયંત્ર રચી રહ્યુ છે અને મને નુકશાન પહોંચાડવા માગે છે.**

**આ આર્ટિકલ - દર્દીએ જાતે લખેલ સત્યકથા છે.**



વિરુદ્ધ કોઈ ખડયંત્ર રચી રહ્યા છે અને કોઈક રીતે નુકશાન પહોંચાડવા માગે છે તેવા વિચારો આવતા. હું નાની - નાની વાતમાં ગુસ્સે થઈ જતી હતી. અતિશય ગુસ્સો કે હું કોઈ સાથે ઝડપો કરું કે મારા શરીરને ઈજા

મારું નામ આરતી છે (નામ બદલ્યુ છે) અને મારી ઉંમર ૨૨ વર્ષ છે. હું એક ડોક્ટરના કલીનિક પર આસ્થિસ્ટના તરીકે જોબ કરું છું. મારી સમસ્યાની શરૂઆત આજથી પાંચેક

મહીના પહેલા થઈ હતી. મારી સગાઈ તુટયા બાદ હું ચિંતાંગ્રસ્ત રહેતી હતી. મારા કામ પર પણ તેની અસર થવા લાગી હતી. ગભરામણા, બેચેની, એક જાતનો ૫૨, બધા મારા વિરોધી છે. મારી

**સતત કંઈક અજ્ઞાત કર રહેતો - મને થતું કે બધા મારા વિરોધી છે, મારી વિરુદ્ધ કોઈ ખડયંત્ર રચી રહ્યા છે અને કોઈક રીતે નુકશાન પહોંચાડવા માગે છે. લોકો મારી સાથે બનતી સારી ઘટનાઓ જોઈ શકતા નથી અને મને હેરાન કરવા માગે છે.**

પહોંચાડુ ત્યારે જ ગુસ્સો શાંત થતો. ગુસ્સામાં હું મારા હાથે કાંડા ઉપર બ્લેડ થી ઈજા પહોંચાડતી અને લોહી નિકળવાનું શરૂ ના થાય ત્યા સુધી બ્લેડ મારવાનું શરૂ જ રાખતી. ગુસ્સો શાંત થઈ

જાય એટલે માથાનો દુઃખાવો શરૂ થતો અને ખુબજ રડવુ આવતું. હું એકધારુ રૂ થી રૂ કલાક રડચા જ કરતી. મને આપદ્યાતના વિચારો આવતા હતા. એક - બે વખત ઘરે ગુસ્સામાં આપદ્યાતની કોશીશ પણ કરી હતી પરંતુ કુટુંબીજનોએ રોકી લીધેલી.

હું વિચારે ચડી જતી કે, બધા મારી વાતો કરે છે. મારા વિરુદ્ધ છે. બધા મને હેરાન કરે છે. મારી સાથે થતી સારી ઘટનાઓ કોઈ જોઈ શકતુ નથી આથી લોકો મને હેરાન કરવા માગે છે. મને એવુ લાગતુ કે મારી જુંદગી સાવ ખરાબ છે. હું પનોતી છું. અભાગાણ છુ. મારે આ પરિસ્થિતીમાંથી કઇ રીતે બહાર નિકળવુ એ સમજાતુ ન હતું.

આ દરમિયાન હું જે કલીનિક પર જોબ કરૂ છું તે ડોક્ટર સાહેબે તેમના સંપર્ક માં રહેલ એક મનોચિકિત્સકની સલાહ લેવાનું સુચન કર્યુ. મનોચિકિત્સક ડોક્ટરે મારી વાત શાંતિથી



હું નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જતી. અતિશાય ગુસ્સો કે હું કોઈ સાથે ઝડપો કરુ કે મારા શરીરને ઈજા પહોંચાડુ ત્યારે જ ગુસ્સો શાંત થતો. ગુસ્સામાં હું મારા હાથે કાંડા ઉપર બ્લેડ થી ઈજા પહોંચાડતી અને લોહી નિકળવાનું શરૂ ના થાય ત્યાં સુધી બ્લેડ મારવાનું શરૂ જ રાખતી.

સાંભળી અને માનસિક રોગની દવાઓની સારવારનો કોર્ષ કરવા સુચયું. તેમણે જણાવ્યું કે દવાઓની અસર પાંચેક દિવસ બાદ શરૂ થાય છે અને દવાઓથી ફાયદો થતા એકાદ મહિનાનો સમય લાગે છે. અને સારુ થયા બાદ

પણ આ દવાઓનો કોર્ષ પૂર્ણ કરવો જરૂરી છે. કોર્ષ આશરે એકાદ વર્ષ ચાલશે તેમ પણ જણાવ્યું. અને મારી માનસિક બિમારીની સારવાર શરૂ થઈ. માનસિક બિમારીની સારવાર શરૂ કર્યાના એકાદ મહિનામાં મને ઘણો ફાયદો જણાયો હતો. મારી ડર, ગભરામણા, બેચેની, રક્યા કરવું, માથાનો દુઃખાવો વગેરે તકલીફોમાં ઘણી રાહત જણાઈ. ગુસ્સો-ગુસ્સામાં પોતાની જાતને ઈજા પહોંચાડવી કે કાંડા પર બ્લેડ મારવી લગભગ સંદર બંધ થઈ ગયું હતું.

સારવારનાં એકાદ મહિના બાદ મને ઘણો ફાયદો જણાયો. મારી ડર, બેચેની, ગભરામણા, રક્યા કરવું, માથાનો દુઃખાવો વગેરે તકલીફોમાં ઘણી રાહત જણાઈ. ગુસ્સો-ગુસ્સામાં પોતાની જાતને ઈજા પહોંચાડવી કે કાંડા પર બ્લેડ મારવી લગભગ સંદર બંધ થઈ ગયું હતું.

આજે જ્યારે હું આ લખી રહી છું ત્યારે (ફેબ્રુઆરી-૨૦૧૮) ના મારી સારવાર ના ત્રણોક મહિના પુર્ણ થઈ ગયા છે. મારી માનસિક બિમારીની દવાઓ શરૂ છે. મારી તબિયતમાં ઘણો સુધારો અનુભવી શકું છું. ગુસ્સા પર કાબુ થતા જાણો મારુ વ્યક્તિત્વ જ બદલાઈ ગયું છે. હાલ કલીનિક પર મારી જોબ પણ શરૂ છે અને હું મારી ફરજ નું કામ વધુ સારી રીતે સ્વરથતાથી કરી શકું છું.

\* \* \* \* \*

## જ. જ્યારે પિતાએ માનસિક બિમારીથી કંટાળી પુત્રને ત્યજી દેવાનો નિર્ણય કર્યો

આ આર્ટિકલ એક સત્યકથા છે.

**શ્રી રોહિતભાઈ જોખી**

મેડિકલ સોશિયલ વર્કર

📞 8980757491

✉️ rohitjoshi0123@gmail.com



જસ્ટમાંતે મિત્રો,

હું છેલ્લા આઠ વર્ષથી સરકારી હોસ્પિટ લના। માનસિક રોગ વિભાગમાં મેડિકલ સોશિયલ વર્કર તરફે ફરજ બજાવુ છું. આજે

મારી સમક્ષ બનેલ સત્યઘટના આ આર્ટિકલ મારફતે રજુ કરુ છું.

મનોજ (નામ બદલ્યુ છે.) ને મે પહેલી વખત માનસિક રોગ વિભાગની ઓ.પી.ડી. મા જોયો. સવારના સુમારે જ્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જમેલી હોય છે. ત્યારે તેના પિતા માનસિક રોગની સારવાર માટે લઈ આવ્યા હતા. ગંદા કપડા, ધણા વખતથી કાઢ્યા ના હોય એવા લાંબા ઓફ્યા વગરના વાળ, લાંબા



નખ, લાંબી દાઢી, તેના મોં  
અને કપડા માંથી દુર્ગધ છુટતી  
હતી. આસપાસના દર્દીઓ  
પણ આ જોઈ અણાગમો  
વર્તાવિતા હતા. પિતાને પુત્રની  
આ સ્થિતિ જોઈ ઘણી શરમ  
આવતી હતી જે તેના ચહેરા પર  
સ્પષ્ટ વર્તાતુ હતુ. પણ મનોજ  
જાણો કોઈ અલગજ દુનિયામાં  
હતો. વિચારશુભ્ય, ચુપચાપ બેસી રહેલ, ક્યારેક કોઈ કારણ વિના  
થોડુ મુસ્કુરાયા કે હસ્યા કરે.

મનોજ ગંદા કપડા, ઘણા વખતથી કાખ્યા  
વગરના ઓળખા વગરના લાંબા વાળ,  
લાંબા નખ, લાંબી દાઢી અને દુર્ગધ  
છુટતા કપડામાં હતો. આસપાસના  
દર્દીઓ પણ આ જોઈ અણાગમો વ્યક્ત  
કરતા હતા. તેના પિતાને પણ આ સ્થિતી  
જોઈ ઘણી શરમ અનુભવાતી હતી.

મનોજ ની તપાસનો વારો આવતા મનોજ ને લઈ પિતા  
ડોક્ટરના કન્સલિટિંગ રૂમમાં પ્રવેશયા. પિતાએ પોતાની વાત શરૂ કરી.  
“સાહેબ હું કંટાળી ગયો છું. આ છોકરાથી હવે તો છેલ્લા પંદર વર્ષથી  
તકલીફ છે. ભણ્યો નહીં, કામ-દંધામાં દ્યાન નહીં., બસ બેઠો રહે,  
ક્યારેક ક્યારેક એકલો-એકલો હસ્યા કરે, ક્યારેક રધવાટ થઈ જાય  
તો ફર્યા કરે, અરે ! નહાવાનું, કપડા પહેરવાનું, બ્રશ કરવાનું કે દાઢી  
કરવાનું પણ ભાન સુંદરા નહીં. કોઈ મહેમાન આવ્યા હોય તો પણ  
તેની જોડે વાત ન કરે, સુનમુન બેઠો રહે, વધુ કહીયે તો ગુસ્સે ભરાઈ  
જાય. મહેમાનને તો એમ લાગે કે અમે આવ્યા તે નહીં ગમ્યુ હોય.  
બધા સરખા ના હોય, હવે તો અમારા ઘરે લોકોએ આવવુ-જવુ બંધ  
કરી દીધુ છે. અમારા સામાજિક સબંધો પણ પહેલા જેવા રહ્યા

નથી.” મનોજના પિતા ગળે  
કુમો ભરાઈંગયો હતો.

ડોક્ટર સાહેબ મનોજ  
ની તપાસ કરી રહ્યા હતા અને  
પિતાની વાત સાંભળી રહ્યા  
હતા.



“અરે સાહેબ, ધર છોડી જતો રહે છે. કચા શોધવો ? એક-બે  
વખત આવુ બન્યુ. એક વખત તો દોઢ મહીને મળ્યો હતો. અમારા ધરે  
થી અંશી કિલોમીટર દુર મંદીર પાસે અવાવડૃ જગાએ પડ્યો હતો.  
એક સનેહીની નજરે પડ્યો તો અમે લઈ આવ્યા. ખૂબ ખરાબ લાગ્યુ,  
ભીખારીની જેમ રહેલો મારો દિકરો. પણ શું કરું સાહેબ લાચાર છુ.  
નોકરી પર ગયો હોઉ તો પણ ટેન્શન રહે કે દિકરો ભાગી તો નહી ગયો  
હોય ને. હવે તો વિચાર્યું છે કે જો સારું ના થાય એમ હોય તો નિરાધાર  
મનોરોગીઓને રાખતા આશ્રમમાં મુકી આવવો.” મનોજના પિતા  
લાગણી વશ થઈ બોલ્યે  
જતા હતા.

‘‘ત મે અે  
મનોરોગીઓને રાખતા  
આશ્રમની કચા રે થ  
મુલાકાત લીધી છે ખરી  
?’’ ડોક્ટર સાહેબે સામો  
પ્રશ્ન કર્યો.

મનોજ ના પિતાએ જણાવ્યું કે મનોજ ધર  
છોડી ને જતો રહે એવું એક-બે વખત  
બન્યું. એક વખત તો તે દોઢ-બે મહીને  
ધરથી અંશી કિલોમીટર દુર મંદીર પાસે  
અવાવડૃ જગાએથી મળ્યો હતો. ખૂબ  
ખરાબ હાલતમાં ભીખારીની જેમ રહેલો.

“હા સાહેબ, મે એક વખત આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમના વ્યવસ્થાપકોએ મનોજને ત્યા રાખવાની હા પણ કહી હતી. હું એક મનોજને સાંચવી શકતો નથી અને તેઓ આવા સો થી દોઢસો મનોજને રાખે છે.

રહેવાની, જમવાની, સુવાની વ્યવસ્થા બદ્યુ મફતમાં કરે છે. આ કામ ખુબજ કઠીન છે. જો કે ત્યા આટ-આટલા લોકોની માનસિક રોગના ડોક્ટર પાસે સારવાર કરાવવી કઠીન છે અને ત્યા એવી કોઈ વ્યવસ્થા પણ મને જણાઈ નહીં. આમ, મારા પુત્રને આશ્રમના હવાલે કરવાથી મને મારા માનસિક રોગથી પિડીત પુત્રની જવાબદારીઓથી તો છુટકારો તો મળી જશે પરંતુ તે કટી સાજે થઈ નોર્મલ જીવન નહીં જીવી શકે.” મનોજના પિતાએ જણાવ્યુ.

“તમે દઈનિ અત્રે દાખલ કરી દો, આપણે દવાઓ વડે સારવાર કરીશું. મારા અનુભવ પ્રમાણે સારવારથી તમારા પુત્રની તબિયતમાં ઘણો સુધારો થશો.” ડોક્ટર સાહેબે સમજાવ્યું.

મનોજને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવે છે. આશરે એકાદ મહિનો મનોજને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવે છે. અને તેની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. આ દરમિયાન મનોજના પિતાએ પોતાના જીવનની પણ

એકાદ મહીનામાં મનોજની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. રોજુંદી કિયાઓ જેવી કે નહાપુ, જાતે કપડા બદલવા, દાઢી કરવી, માથુ ઓળવું, બ્રશ કરવું ઉપરાંત અન્યો સાથે વાતથિત કરવી અને રોજુંદી પ્રવૃતીઓમાં રસ લેવાનું શરૂ કરે છે.

ઘણી વાતો કરી. કેવા સંજોગોમાં તેમણે અન્ય જ્ઞાતિની ચુપતી સાથે પરિવારજનોની વિરુદ્ધ જઈ લગ્ન કર્યા. મનોજનો જરૂમ અને બાળપણા, પટનીનો જીવી સ્વભાવ અને આખરે છુટા પડવું, પુત્ર નો બાળપણથી જ એકલા હાથે ઉછેર અને છેલ્લા પંદર વર્ષથી શરૂ થયેલ માનસિક બિમારી અને જેના લીધે વેઠવી પડેલી ચાતનાનો, તંત્ર - મંત્ર-દોરા-ધાગા-અંદરુદ્ધાનો સહારો અને આખરે છેલ્લે હારી - થાકીને પુત્રને ત્યજી દેવાનો “આશ્રમ” ને હવાલે કરવાનો નિર્ણય કરેલો. મને પણ મનોજના કેસમાં રસ પડવા લાગ્યો હતો.

એકાદ ભહિના બાદ મનોજની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. રોજુંદી કિયાઓ જેવી કે, નહાવુ, જાતે કપડા બદલવા, દાઢી કરવી, માથુ ઓળવું, બ્રશ કરવું વગેરે જાતે જ કરે છે. અન્યો સાથેની વાતચિતમાં પણ સુધારો જોવા મળ્યો છે. સુમસામ વિચારશુન્ય બેસી રહેતો મનોજ અન્ય દર્દીઓ અને પિતા સાથે તેમજ રાઉન્ડ દરમિયાન ડોક્ટર સાથે વાતચિત કરે છે અને રોજ-બરોજની પ્રવૃત્તિઓમાં રસ લે છે. મનોજના પિતા પણ મનોજની તબિયત સુધરતા ઘણા ખુશ છે અને તેમને દવાઓ લાંબો સમય શરૂ રાખવાની અને ડોક્ટરની સલાહ વિના દવાઓમાં કોઈ ફેરફાર ન કરવાની કાક

મનોજ ને સ્કિપ્પોફેનિયાનામની બિમારી  
છે. સારવાર દરમિયાન રાખેલ ધિરજ  
અને દવાખાનેથી રજ લીધા બાદ પણ  
નિયમીત દવા લેવાની સમયસુચકતા  
ખૂબજ જરૂરી છે. તેમજ દર્દી હાલ  
જવાબદારી ના લઈ શકે હોય તેવા કામનું  
દબાણ ના કરવું જોઈએ.

સુચના સાથે વોર્ડ માથી રજા આપવામાં આવે છે.

આ વાતને આજે છ એક મહિનાનો સમય થવા આવ્યો છે. મનોજ દર મહિને પિતા સાથે હોસ્પિટલમાં તપાસ તથા દવા માટે આવે છે. મનોજના પિતા પણ પુત્રની હાલની સ્થિતીથી સંતુષ્ટ છે. અને પોતે પુત્રને ત્યજી દેવાના લીધેલ નિર્ણય પર કચારેક અફ્સોસ પ્રગટ કરે છે. હાલ મનોજ માટે કોઈ નાનકડી નોકરી કે જેથી મનોજ પ્રવૃતીશીલ રહી શકે તેની તપાસ કરતા રહે છે.

મનોજની બિમારીનું નામ સ્ક્રિઝોફેનિયા છે. આ બિમારીમાં દર્દીની સારવારમાં સગાની ભુમિકા પણ અગત્યની છે. મનોજની સારવાર દરમિયાન રાખેલ ધિરજ અને વોર્ડમાંથી રજા લીધા બાદ પણ નિયમીત દવા લેવાની સમયસુચકતાનો મનોજની સારવારમાં મળેલ સફળતામાં સિંહફાળો છે. આ બિમારીની સારવારમાં ધીરજ અને દર્દી પર તે હાલ ન કરી શકે તેમ હોય કે હાલ જવાબદારી ના લઈ શકે તેમ હોય તે બાબતનું ખોટુ દબાણ ના કરવું (જેમકે હાલ મનોજના કેસમાં પૈસા કમાવા, નોકરી કરવી કે લગ્ન કરવા) ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.

\* \* \* \* \*



## માનસિક સ્વાસ્થ્ય અને આપણે

જુના અંદો તેમજ નિયમીત સબસ્ક્રીપ્શન માટે :

🌐 [drijratnani.com/magazine](http://drijratnani.com/magazine)

📞 9925056695

✉️ [ratnaniclinic@gmail.com](mailto:ratnaniclinic@gmail.com)

## પ. સેકસ સમસ્યાઓ (પુરુષોની) ભાગ-૨ સચિત્ર

### ૧. સેકસ પ્રત્યે અરુચી-સેકસ ની ઈચ્છા નો અભાવ કે સેકસ પ્રત્યે આણગમો -

**કારણો :**

#### શારીરિક કારણો

- વિટામીન બી-૧૨, ઈસ્ટ્રોજન, થાયરોઇડ કે ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવો ની ઉણાપ કે પ્રોલેક્ટિન નો વધુ પડતો સ્ત્રાવ



#### માનસિક કારણો

- ડિપ્રેશન, એંજક્ઝાયટી ડિસાર્ક્રિફ્ટ, ચિંતારોગ, અનિદ્રા, માનસિક તાણાવ, બેચેની, મુંજારો

#### સમાજીક કારણો

- સબંધોમાં તાણા, ગૃહકંકાસ, સાથી પ્રત્યે નો આણગમો-વ્યક્તિઓ પ્રત્યેના રોજુંદા સબંધો અને સેકસ સબંધો ને એકદમ અલગ ના કરી શકાય - જો રોજુંદા સબંધો તાણાભર્યા હોય તો સેકસ સમસ્યા ઉદભવવી સ્વાભાવિક છે.




#### સારવાર

**દવાઓ**

- સાયકોથેરાપી-સેકસ થેરાપી : જેમા દર્દિના સાથી સાથેના સબંધો સુધારવા પર ભાર મુકવામાં આવે છે.

## ૨. શિદ્ધપતન

➢ સેક્સ સબંધમાં પુરુષ કે સ્ત્રી પેકી કોઈને ચરમસિમાનો અનુભવ ના થયો હોય ત્યા જ વિર્યસ્ત્રાવ થઈ જાય. સામાન્ય રીતે એક મિનિટ કરતા પણ ઓછો સમય ચાલતા સેક્સ સબંધને શિદ્ધપતન કરે છે.



## શારીરિક કારણો

➢ મગજમાં સિરોટોનિન નામના રસાયણાની ઉણાપ

## માનસિક કારણો

➢ તણાવ, ડિપ્રેશન, પફ્ફોમન્સ એન્ક્રાયટી (પ્રદર્શન ચિંતા), સેક્સ પ્રત્યેની ગેરમાન્યતાઓ કે અપરાધભાવ

## સારવાર

દવાઓ

➢ સેક્સ થેરાપી સેક્સના આસનોમાં ફેરફાર



દવાઓ



કાઉન્સેલીંગ તથા સાઇકોથેરાપી



ચેતવણી - બજારમાં મળતા સેક્સ ટોનીક્સ, તેલ, ચંત્રો કે સ્ટેમ્નિના વધારવાની દવાઓનો ઉપયોગ ન કરવો.

\* \* \* \* \*

## ડ. કસરત અને માનસિક સ્વાસ્થ્ય

**ડૉ. શ્રેયા ત્રિવેદી (M.P.T., Cardio-Respi.)**

મદદનિશ પ્રાદ્યાપક અને ઈન્ચાર્જ પ્રિન્ટીપાલ

શ્રી સહજાનંદ ઈન્સટિટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી, ભાવનગર

📞 9428639469

✉ shreya\_trivedi9@yahoo.co.in



કસરત કરવાથી શારિરિક સ્વાસ્થ્ય સારુ રહે જે આપણેસો જાણીએ છીએ પરંતુ કસરતની માનસિક સ્વાસ્થ્ય અને મુક પર પણ હકારાતમક અસર થતી હોય છે જે વાત એટલી જાણીતી નથી. સામાન્ય અને રોજુંદા જીવનમાં કરી શકાય એવી કસરતો જેમકે, દરરોજ ચાલવુ, સાઈકલ ચલાવવી, સ્થિર્મિંગ કરવુ વગેરેની શરીરની સ્વસ્થ્યતા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર પણ હકારાતમક અસર થતી હોય છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં એ વાત સાબિત થઈ છે કે દરરોજ કરવામાં આવતી સામાન્ય કસરતો નો શારિરિક સ્વાસ્થ્ય ની

નિયમીત કસરત વડે મગજમાં “હેપી હોર્મોન”  
નું પ્રમાણ વધે છે. જેની ગુર્જો, ચિકીયાપણુ,  
માનસિક ટેન્શન થાક, મુક, મિજાજ,  
ચાદરાકિત, તર્કશાકિત અને કાર્યક્ષમતા પર  
હકારાતમક અસર જોવા મળે છે.

જેમજ માનસિક સ્વાસ્થ્ય  
સાથે પણ ઘનિષ્ઠ સબંધ  
હોય છે. અને જેઓ  
કસરત કરતા નથી તેવા  
વ્યક્તિઓની સાપેક્ષે  
નિયમીત કસરત કરતા  
વ્યક્તિઓ શારિરિક અને  
માનસિક રીતે વધુ



સ્વસ્થ હોય છે. આજે આપણે આ આર્ટિકલમાં નિયમીત કસરતની માનસિક સ્વાસ્થ્ય પરની હકારાતમક અસરોની ચર્ચા કરીશું.

## બાળકો અને ચુવાનોમાં કસરત ની માનસિક સ્વાસ્થ્ય પરની અસર

કસરત વડે મગજના વિવિધ ભાગોને મળતા લોહી તથા પોષક દ્રવ્યોમાં વધારો થાય છે. જે મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. જે બાળકો અને ચુવાનો શારીરિક પ્રવૃત્તિ, ખેલકુદ અને કસરતમાં ભાગ લે છે તેમનો મગજનો વિકાસ અન્ય બાળકો ની સાપેક્ષે વધુ હોય છે. જે બાળકો તથા ચુવાનોએ શારીરિક પ્રવૃત્તિ કે કસરતમાં ભાગ લીધો છે તેમનો માનસિક વિકાસ, યાદશક્તિ, તર્ક શક્તિ, લાંબાગાળા સુધી માનસિક શ્રમ કરવાની ક્ષમતા, અને એકાગ્રતા અન્ય બાળકો ની સાપેક્ષે વધુ હોય છે. જેથી તેઓ શિક્ષણ અને અભ્યાસમાં પણ સારુ પ્રદર્શન કરી શકે છે. શારીરિક પ્રવૃત્તિઓ કે કસરત કરતા બાળકો વધુ લાંબો સમય થાક્યા વિના માનસિક પરિશ્રમ કરી શકે છે.

## વૃદ્ધાવસ્થામાં માં કસરત ની માનસિક સ્વાસ્થ્ય પરની અસર

વૃદ્ધાવસ્થાની માનસિક તકલીફો જેવીકે, યાદશક્તિમાં ઘટાડો, વારંવાર કામમાં ભુલ થવી, સ્વભાવ ચિહ્નિઓ થવો, વગર કારણે મુડ

ઉદાસ રહેવો વગેરેમાં પણ રોજુંંટી સામાન્ય કસરત અમુક અંશે ફાયદારૂપ થઈશકે છે.

### મગજ અને માનસિક રોગના દર્દીઓમાં માં કસરતથી થતા ફાયદા

નોર્મલ બાળકો-ચુવાનો અને વૃદ્ધો ના માનસિક સ્વાસ્થ્ય પર થતી કસરતની હકારાત્મક અસર ઉપરાંત મનોરોગીઓ અને માનસિક બિમારીથી પિડાતા દર્દીઓને નિયમીત કસરતી ફાયદો થાય છે. નિયમીત કસરત મગજમાં “હેલ્પી હોર્મોન” (મગજ ને જરૂરી એવા ન્યુરોટ્રાન્સમીટર-સિરોટોનીન, ડોપામીન અને નોર-એપિનેફીન, જેની ઉણાપ કે અપુરતુ પ્રમાણા ડિપ્રેશન જેવા અનેક રોગોનું કારણ છે.) નું પ્રમાણા વધારે છે. નિયમીત કસરત વડે ગુસ્સો, ચિડીયાપણા, માનસિક ટેન્શન, માનસિક થાક, મુડ-મિજાજ, ચાદશક્તિ તર્કશક્તિ અને કાર્યક્ષમતા સબંધીત પ્રશ્નો પર પણ હકારાત્મક અસર જોવા મળે છે.

આમ, નિયમીત કસરત એ કોઈપણ ઉંમરની નોર્મલ વ્યક્તિ તેમજ માનસિક રોગથી પિડીત વ્યક્તિ ના માનસિક સ્વાસ્થ્યમાં અમુકઅંશે ફાયદારૂપ છે. અને જો સ્વસ્થ વ્યક્તિ પણ કસરત ને જીવનનો ભાગ બનાવે અને નિયમિતતા કેળવે તો તે ના મગજ ની કાર્યક્ષમતા માં સુધારો જોવા મળે છે.

**નિયમીત કસરત બાળકો તથા ચુવાનોની ચાદશક્તિ, તર્કશક્તિ, માનસિકક્ષમતા, લાંબા સમય સુધી માનસિક શ્રમ કરવાની ક્ષમતા અને એકાગ્રતા વધારે છે.**

## 7. How Depression look like ?

**Dr. Elavatsala Sharma**

Psychiatrist & Psychotherapist



📍 **Sesenity New Psychiatry clinic**

Shop no.14, Second Floor, Galaxy hub,  
Beside Linde house, Near Nilamber Triumph  
Circle, Gotri Bhayli Road, Vasna, Vadodara.

📞 7043365111 📩 drvatsalaela@gmail.com

Depression doesn't always look sad. It is much more than the sadness we see. It can be chronic aches, a forced smile through out the day, a friend cancelling plans in order to avoid social engagements. Many struggle in silence and never seek help. As due to stigma and social pressures help seems something difficult to access. Depression is not a one-size-fits-all-illness. Just like any other disease, depression can take many forms. Contrary to the myths, depression can happen to anyone. Though change in appetite and food intake leading to weight loss or weight gain, changes in quality and quantity of sleep, difficulty in concentrating and memorizing things, feeling lost most of the time, apathy; which is lack of initiation to do any work or to involve with any other person. Aches and pains: Many times it is the only symptom present with sadness surrounding it. And most importantly thoughts of ending one's own life by committing suicide.

People tend hide these symptoms or feeling as they feel they will be judged. Usually we hear these things like "Stay strong, don't act so weak", "Stop crying like a girl", Boys don't cry", only weak people go into depression", Don't act like a child, grow up, it happens to everyone" and so on. An endless list of advices are given which actually makes it even more difficult for people to come out. Its high time we should realise that its a treatable illness and not merely sad mood and we should help people empathetically to come out for help.

\* \* \* \* \*

### Disclaimer

- અતે ચર્ચેલ રોગ, નિદાન અને સારવાર અંગેની સુચનાઓ માત્ર પ્રાથમિક સમજણા માટે છે. દર્દિના લક્ષણો, દવાની અસરો વગેરે દર્દિની તાસીર મુજબ હોઈ સારવાર માટે નિષ્ણાત તબીબનો અભિપ્રાય અનિવાર્ય છે.
- અતે દર્શાવેલ સુચનાઓને ડોક્ટરનો અભિપ્રાય માની લેવો નહીં.
- આ મેગેઝીન મગજ અને માનસિક રોગની જાગૃતી લાવવાનાં શુભ હેતુથી શરૂ કરેલ છે. આપના વાંચન બાદ અન્યોને વાંચવા આપી જન જાગૃતી અભીયાનમાં સહભાગી બનનું.
- મેગેઝીનમાં ચર્ચેલ કેસોમાં દર્શાવેલ દર્દિના નામો બદલીને લખેલ છે.

**ડૉ. આઈ. જે. રત્નાએ M.D.**

મગજ અને માનસિક રોગ નિષ્ણાત

**ઓજસ ન્યુરોસાઇક્યાટ્રી ક્લિનિક**

સેકન્ડ ફ્લોર, શ્રી મણી પલાશા, કાળુલા રોડ, કાળાનાળા, બાવનગર- ૩૯૪૦૦૧

સમય સવારે ૧૧ થી ૧, સાંજે ૬ થી ૮ ૦ 9978739359

RNI Registration No. GUJBIL/2017/73989

# MANSIK SVASTHYA ANE AAPANE

## માનસિક સ્વાસ્થ્ય અને આપણે

Book-post

Printed Matter



તંત્રી

**ડૉ. આઈ. એ. રચનાથી**

માગજ અને માનસિક રોગ નેણુંાં

શ્રી મધ્યી પ્લાઝ, કાળુલા ગેડ,  
ડાણાનાણા, ભાવનગર- ૩૬૪૦૦૧.

૦૭૯૮૭૩૬૩૫૬

Printed Published, Owned and Edited by I. J. RATNANI

Printed at Vanshika Forms, F-12, Sanghvi Plastic Compound, Tekari Chowk,  
Ruvapari Road, Bhavnagar, Gujarat, India Pin-364001Published at Bapu Mehta Street, Amba Chowk, Bhavnagar, Gujarat, India Pin-364001  
Editor : I. J. RATNANI